



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૯/૦૩/૨૦૧૯ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૬૬/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૭૯ કેસ કરી, ૭૪ વ્યક્તિઓને ઝડપી, ૩૯૯ લીટર દેશી દારૂ, ૨૨૯ બોટલ ઇંગ્લીશ દારૂ, ૧૬૮ બિયર ટીન, ૧ આઇશર ગાડી, ૧ કાર અને ૧ મોટર સાયકલ કબજે કર્યું હતું. તેમજ જુગારધારા હેઠળ ૨ કેસ કરી ૧૮ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૬૭,૩૬૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૬૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૮૯૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૦૯ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૫૬૮/૧૯

વસ્ત્રાપુર: વિવેકાનંદ ભરતપ્રસાદ સિંહ (રહે, સુરસાગર એપાર્ટમેન્ટ પ્રેરણાતીર્થ દેરાસર પાસે, જોધપુર સેટેલાઈટ) એ તા.૨૮/૩/૧૯ નારોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૧/૦૯/૧૭ થી તા.૨૩/૧૧/૧૮ સુધીના સમયગાળા દરમિયાન એસ.જી.હાઈવે ગુરુદ્વારા સામે ઝોડીયાક સ્કવેર બીલ્ડીંગમા ગ્રાઉન્ડ ફ્લોર એસ.બી.આઈ.બેંક ખાતે આરોપી મેસર્સ સફલ ફ્લેક્સી બોન્ડ પ્રા.લી.ના ડાયરેક્ટરો તથા જામીનદાર (૧) હેમલ ઠક્કર (રહે,બારમો માળ ગાલા હેવન ફ્લેટ, વૈષ્ણોદેવી સર્કલ પાસે, એસ.પી.રીંગ રોડ અડાલજ) (૨) નીરુબેન ઠક્કર (રહે. વહેલાલ કો.ઓ.હા.સો.લી. કુમારશાળા પાસે નરોડા) તથા (૩) પુનમબેન પટેલ (રહે, વિનાયક હાઉસ ઓફવ ગામ જવાના નાકા પાસે, ઓફવ) એ ભેગા મળી બેંકમા તેઓએ તેઓની કંપની બાબતે અગાઉથી એચ.ડી.એફ.સી.બેંકમા તેઓની મિલકત મોર્ગેજ કરેલ હોવા છતા તે મોર્ગેજવાળી મિલકત ઉપર મિલકતના દસ્તાવેજ બેંકમા રજુ કરી તેઓએ વ્યવસાય કરવા તેમજ ધંધા અર્થે કેશક્રેડીટ લોન તથા ટર્મ લોન પેટે કુલ રૂપિયા ૨૩,૫૦,૦૦,૦૦૦/- ની માગણી બાબતની અરજી કરી જે લોન બાબતે તેઓના દસ્તાવેજ કાગળો ચકાસણી કરી તેઓની માગ્યા મુજબની લોન સેન્શન કરી તે લોન એચ.ડી.એફ.સી.બેંકમા ટેકઓવર કરાવી અને તે બેંકમા મુકેલ મોર્ગેજ મિલકતના કાગળો બેંકમા મોર્ગેજની નોંધણી કરવા આજદીન સુધી નહી આવી, તેમજ જામીનદાર પુનમબેન નાઓએ પણ મદદગારી કરી બેંક સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી એમ.એમ.જાડેજા ચલાવે છે.

કાલુપુર: નવીનભાઈ વિનયભાઈ ખંડુજા (ઉ.વ.૩૨)(રહે.ગોયેલપાર્ક રો-હાઉસ અમુલ ડેરી પાસે જસીસ બંગલો રોડ બોડકદેવ) એ તા.૨૮/૩/૧૯ નારોજ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૩/૦૭/૧૮ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન કાલુપુર ગાંધી રોડ બાલા હનુમાન મંદીરની સામે દુકાન નંબર-૧૭૧૨ “ખંડુજા માર્કેટીંગ પ્રાઇવેટ લીમીટેડ” નામની દુકાન માંથી આરોપી કૌશલ મહેન્દ્રભાઈ ભાવસાર (રહે. નંદનવન બંગલો એવરગ્રીન સોસાયટી ધુમા બોપલ) એ નવીનભાઈને વિશ્વાસમા લઈ ઈલે.વસ્તુઓ અને પંખાનો સામાન ઉધારમાં લઈ, કોટક મહીન્દ્રા બેંકના એકાઉન્ટમાંથી ગાયત્રી સેલ્સના આંધ્ર બેંકના કાલુપુર શાખાના બેંક એકાઉન્ટમાંથી કુલ રૂપિયા ૫૬,૬૫,૦૦૦/- જમા કરાવ્યા હોવા છતાં રવી માર્કેટીંગ લીમીટેડ કંપનીના રોલ ખાતે જમા નહીં કરાવી પંખાનો માલ કે રૂપિયા આજદીન સુધી નવીનભાઈ ને પરત નહીં આપી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.જી.વસાવા ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૫૬૯/૧૯

દરીયાપુર: રાજશ્રીબેન વા/ઓ અરવિંદભાઈ દાતણીયા (ઉ.વ.૪૭)(રહે,ગાંધીવાસ વિભાગ-૨, સતકેવલ નગરના છાપરાં ટોલનાકા સાબરમતી) તા.૨૮/૩/૧૯ નારોજ દરીયાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૪/૦૩/૨૦૧૯ સાંજના ૬/૦૦ વાગ્યાના સુમારે દિલ્લી ચકલા ચાર રસ્તા રેડીયો હોટલની સામે આવેલ શીવાંસ જ્વેલર્સ આગળ બે અજાણી મહીલાઓ (૩૦ થી ૪૦ વર્ષના આશરાની) એ રાજશ્રીબેનની થેલીમાં મુકેલ પાકીટ કે જેમા સોનાની બુટી નંગ-૨ અને સોનાની કાનની વાળી નંગ-૨ કુલ કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.એ.પાટીલ ચલાવે છે.

એરપોર્ટ: વિષ્ણુભાઈ ગોબરદાસ પટેલ (ઉ.વ.૫૮)(રહે.સાર્થકહોમ પી.ડી.પી.યુ.રોડ રાયસણ ગાંધીનગર) તા.૨૮/૦૩/૧૯ સાંજના ૬/૪૦ વાગ્યાના સુમારે નોબલ ટર્નીંગ પાસે સુભાષનગર સામે એશિયન ગ્રેનાઇડ નામની ફેક્ટરી આગળ પોતાની સ્વીફ્ટ ગાડી ઉપર અજાણી વ્યક્તિએ ઓઇલ નાંખતા, વિષ્ણુભાઈ બોનેટ ઉંચુ કરી જોતા હતા ત્યારે તેમની નજર ચુકવી ગાડીની સીટ ઉપર મુકેલ બેગ કે જેમા રૂપિયા ૪૦,૦૦૦/- તથા ફેક્ટરીના હિસાબોના કાગળો હતા તે બેગની ચોરી કરી લઈ ગઈ છે. આ અંગેની ફરીયાદ વિષ્ણુભાઈ પટેલે એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.બી.પ્રજાપતી ચલાવે છે.

કરંટ લાગતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૫૭૦/૧૯

માધવપુરા: શાહપુર દરવાજા કમુમીયાની ચાલી ફાયર બ્રીગેડ પાછળ રહેતા શૈલેષભાઈ ખોડાભાઈ બોડાણા ની ૫ વર્ષની પુત્રી નેનશી તા.૨૮/૩/૧૯ કલાક ૯/૦૦ વાગ્યાના સુમારે ઘરની બહાર લોખંડની સીડી ચડતી હતી ત્યારે વિજ કરંટ લાગતાં, સારવાર માટે તેને વા.સા.હોસ્પિટલ ખાતે લઈ જતાં, ફરજ પરના ડૉ.શ્રીએ તેને મૃત જાહેર કરી હતી. આ અંગે માધવપુરા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એલ.એચ.પારઘી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.